

Heart to Heart



# ગુરૂ શાસ્ત્રીય

પ્રિયમુ

॥ ણમોત્થુ ણં સમણસ્સ ભગવાઓ મહાવીરસ્સ ॥  
॥ આયાઓ ગુરુબહુમાણો ॥

# નારી ગારિભા

તમારી ૧૫ વર્ષની દીકરીને  
અચ્છૂ વંચાવવા જેવી  
સત્ય-ઘટનાઓ

પ્રિયમ्

અહો શ્રુતમ्  
શા. બાબુલાલ સરેમલજ  
સિદ્ધાચલ બંગલો, હીરા જૈન સોસાયટી,  
સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો. ૯૪૨૬૫૮૫૮૦૪  
ahoshrut.bs@gmail.com

મહા, વિ. ૨૦૭૭

Book Link : [bit.ly/priyambooks](http://bit.ly/priyambooks)

(આ લિંકથી બધી જ બુક્સ ફીમાં મળશે, જરૂર અનુસાર આપ સ્વયં પ્રિન્ટ કાઢી શકશો.  
પુસ્તકમાસિ માટે લિંક ઉપયોગી થશે, પુછતાછ માટે સંપર્ક ઉપયોગી થશે.)

## વિષયાનુક્રમ

NO..... ARTICLE .....	PAGE
1 ..... I ask you : કાન્તા .....	3
2 ..... Choice Yours : લાલબાઈ .....	૫
3 ..... Want to be a living dead body ? : રાણકદેવી .....	૭
4 ..... Plz. Ask Once : સોહુનદેવી .....	૧૦
5 ..... Eyes or Movie ? : સત્યવતી .....	૧૨
6 ..... Never third : પદ્માવતી .....	૧૪
7 ..... યા શીલ યા કશું નહીં : વીરમતી .....	૧૬
8 ..... Decoration of a dead-body : દુર્ગાવતી.....	૧૮
9 ..... સાર .....	૨૧

\*

Thanks to

પુस્તક : આર્દ્ર નારિયાઁ  
પ્રકાશક : સાધુમાર્ગી પબ્લિકેશન  
લેખક : શ્રી ધર્મશમુનિજી મ.સા.

જેમાંથી ઘટનાઓને પસંદ કરીને ખૂબ સંક્ષિમતૃપે કરીને  
શીલસંદેશ ઉમેરીને અહીં રજુ કરવામાં આવી છે.

\*

## \* I Ask You \*

“તરલા !

આપણને અહીં કોણ દુષ્ટ ઉપાડી લાવ્યું છે ?

આપણું અપહુરાગ કરનારનું નામ આપ.

તું એના ગ્રાણ લઈને મારા શીલની રક્ષા કરીશ.

ચા શીલની રક્ષા માટે મારા ગ્રાણોની આદૂતિ આપી દઈશ.”

“રાજકુમારી કાન્તા ! આપ મારી વાત સાંભળો,

અત્યારે આપણે પાટણમાં રાજકુમાર કર્ણના મહેલમાં પૂરાયેલા છીંઅ.

અહીં આપણને બચાવનાર કોઈ નથી.

એ બહુ જ શક્તિશાળી છે.

આપણે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરીએ,

તો એ આપણી સાથે જબરદસ્તી પણ કરી શકે છે.

ને આપણી હત્યા પણ કરી શકે છે.

સાંભળ્યું છે કે ઓણો આપના પતિ સૂર્યેનને ય ખતમ કરી દીધા છે.

તો હવે એમને આધીન થવું એ જ એક ઉપાય છે.”

“ખબરદાર તરલા ! તું દાસી છે,

ને તારી વાત પણ દાસી જેવી જ છે.

મને લાગે છે કે તું પોતે તો ભષ થઈ જ ચૂકી છે,

ને હવે મને પણ ભષ કરવાનો પ્રયાસ કરે છે.

નીકળી જા અહીંથી,

તારું કાળું મોં મને દેખાડતી નહીં.

તું ફૂતરી હોઈશ,

જેને ગમે તેટલા ફૂતરા ભોગવી શકે.

તું એક સત્તારી છું.

મારો સ્પર્શ યા મારા પતિ કરી શકે,

યા અગ્રી કરી શકે.

ત્રીજી કોઈ વ્યક્તિ મને રૂપર્ણી જ ન શકે.

ને મારા પતિ ખતમ થઈ ગયા.

આ વાત પણ સાવ ખોટી છે.

જો આ મોતીની માળા.

જે એમણે મને યુદ્ધ માટે જતા પહેરાવી હતી.

ને કદ્યું હતું કે ‘જ્યાં સુધી આ માળા અખંડ રહેશે,

ત્યાં સુધી તારું સૌભાગ્ય અખંડ રહેશે.

મારા પતિ જીવતા છે,

એ આવશો, ને એ દુષ્ટને ખતમ કરીને

મારા શીલની રક્ષા કરશે.

જા, નીકળી જા અહીંથી.’’

\* \* \* \* \*

‘યુવરાજ કર્ણ ! તમે ચિંતા ન કરો,

આજે મધરાતે એમની મોતીની માળા તોડી દેવાની,

જવાબદારી મારી, ને કાલે મારી સ્વામિની તમારી...’’

\* \* \* \* \*

તરલા મધરાતે બારીમાંથી અંદર જઈને

તીક્ષ્ણ છરીથી એ માળા તોડી દે છે.

સૂરસેન કાન્તાને બચાવવા આવી પહુંચે છે.

એ ક્ષાળે કાન્તા

હુય પ્રાણનાથ કહીને સળગતી ચિત્તામાં કૂદી પડી હોય છે.

સૂરસેન પણ એ જ ચિત્તામાં કૂદી પડે છે.

આખી જનતા કર્ણ અને તરલાને વિકારે છે.

પરિણામે તેઓ ય ઝેર પીને મરી જાય છે.

\* \* \* \* \*

શું શીલ એ સસ્તી-નાંખી દેવા જેવી વસ્તુ છે ?  
 શું નારી અને ફૂતરીમાં કોઈ જ ફરક નથી ?  
 શું ભષ્ટા સાથે કદી સાચો આનંદ હોઈ શકે ?  
 શું ઘણાની હોય એ કોઈ એકની પણ હોઈ શકે ?  
 શું આપણા લાખો પૂર્વજોની પરંપરા ખોટી હુતી ?  
 શું આજની નારી ખરેખર સુખી થઈ છે ?

I ask you, Plz. Answer me.



### \* Choice Yours \*

ઉદ્યપુરના મહારાણા જ્યાંસિંહ.  
 એમની લાડલી રાજકુમારી લાલબાઈ.  
 એનો સ્વયંવર યોજાયો છે.  
 લાલબાઈ વરમાળા લઈને ચાલી રહી છે.  
 દેશ દેશના રાજાઓ અને રાજકુમારોનો પરિચય અપાઈ રહ્યો છે.  
 ને લાલબાઈ આગળ ચાલી રહી છે.  
 “આ છે અનહુલવાડાના રાજકુમાર અનહુલરાય...”  
 જેમ જેમ વર્ણન થતું ગયું,  
 તેમ તેમ લાલબાઈ એમની થતી ગઈ.  
 એ મનથી તો એમને વરી જ ગઈ હતી.  
 બાકી હતી વરમાળા પહેરાવવાની.  
 એણે હાથ ઊંચા કર્યા... હાથ લંખાવ્યા.  
 અનહુલરાયના ગળામાં એ વરમાળા ટળે  
 એ પહેલા જોરથી એક ભાલાનો પ્રહાર થયો.  
 એક રાજકુમારે એ વરમાળાને ભાલાથી આંચકી લીધી.  
 ને પોતે જ પહેરી લીધી. એ હતો કચ્છનો રાજકુમાર તાજપાલ.

આખી સભામાં હલચલ મચી ગઈ.  
 અનહુલરાયે ગુસ્સાથી તાજપાલ પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો.  
 તાજપાલે પોતાનો બચાવ કરીને  
 ભાલાનો એવો મરણતોલ પ્રહાર કર્યો,  
 કે અનહુલરાયનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું.  
 આખી સભા સ્તબ્ધ છે,  
 લાલબાઈ વિચાર કરે છે કે  
 'મેં મનથી તો એમને પતિ તરીકે સ્વીકારી જ લીધા છે.  
 એક સમારીના જીવનમાં  
 કદી બે પતિ તો નથી જ હોતા,  
 બીજા પતિનો વિચાર સુદ્ધા નથી હોતો.  
 શીલ એ જ સમારીનું જીવન હોય છે.  
 શીલહૃત્યા એ જ ઓની હૃત્યા હોય છે.  
 મારા પતિ ગયા.  
 હું જો મારે જીવનું હશે,  
 તો મારા માટે આવી હૃત્યા કરનારા  
 માણસના હાથે મારું શીલ ચૂંથાવા દેવું પડશે,  
 જે મને હરગીઝ મંજૂર નથી.'  
 એક જ કાળમાં લાલબાઈ નિર્ણય લઈ લે છે.  
 અનહુલરાયના દેહમાંથી ભાલાનો ધારદાર ભાગ  
 બહાર ખેંચી કાઢે છે.  
 અને કોઈ કંઈ સમજે તે પહેલા જ  
 પોતાના પેટમાં એ ભાલો ભૌંકી દે છે.  
 કંઈ ચિકિત્સા થાય  
 એ પહેલા અનું પ્રાણપંખેરું ઉડી જાય છે.  
 અના મુખ પર શીલરક્ષાનો પરમ સંતોષ વર્તાઈ રહ્યો છે.

કાણિક સુખ માટેની ખંજવાળ  
 અને તેને દૂર કરવા માટે  
 અવનવી વ્યક્તિ સાથેની ગંદી ચેષ્ટા તો  
 ભૂંડણા ભવમાં પણ હોય છે.  
 માનવીય સભ્યતા  
 એનાથી જે કારણે જુદી પે છે  
 એનું નામ છે શીલ.

માનવીય સભ્યતા.... પરિવાર... વિશાસ... વફાદારી...  
 પ્રેમાળ લાગણી... સમર્પણ... સાત્ત્વિક સંતતિ... પ્રસત્ર જીવન -  
 આ બધું જ જેના કારણે ટકે છે.  
 એનું નામ છે શીલ.  
 ભૂંડણા જેવી જિંદગીમાં  
 ભૂંડણા કદાચ સુખી હોઈ શકે,  
 નારી નહીં.



### \* Want to be a Living Deadbody ? \*

જુનાગઢના રાજા રા'ખેંગાર.  
 એમની રાણી હતી રાણકદેવી.  
 એના પર મોહિત બનેલ સિદ્ધરાજ.  
 પાટણથી બે વાર વિશાળ સેના લઈને ચડી આવ્યો  
 પણ બંને વાર એણે પરાજિત થઈને ભાગવું પડ્યું.  
 ત્રીજી વાર એ વિશાળ સેના લઈ આવ્યો.  
 રા'ખેંગાર સિદ્ધરાજનો બંધી બન્યો.  
 રાણકદેવીને જેવી આ વાતની જાણ થઈ.  
 ઓવું એનું ક્ષાત્ર તેજ જળકી ઉક્યું.

એ પોતે તો શાસ્વતજી બની જ  
 વિધવા ક્ષત્રિયાણીઓને ય એણે પ્રોત્સાહિત કરી.  
 ૫૦,૦૦૦ સ્ત્રીઓની સેના સાથે એ તૂટી પડી.  
 સિદ્ધરાજનું બધું જ જોશ ભાંગી પડ્યું.  
 એ ભાગવા જ જતો હતો.  
 ત્યાં એની માતા મીનણદેવી બીજી સેના લઈને પહોંચી ગઈ.  
 યુદ્ધ જામ્યું,  
 રાણકદેવી ઘાયલ થઈ, જીવતી પકડાઈ.  
 પોતાનો સ્વીકાર કરે એ માટે  
 સિદ્ધરાજે આકાશ પાતાળ એક કર્યા,  
 એ વશ તો ન થઈ.  
 ઉપરથી સિંહણની જેમ વીફકી...  
 “કુષ... પાપી... નીચ... શરમ નથી આવતી તને  
 ધિક્કાર છે તારી લંપટતાને...”  
 આવા શબ્દોથી એની ઝાટકણી કરી નાંખી.  
 સિદ્ધરાજે કોધાવેશમાં આવીને  
 એના પતિનું માથું કાપી નાંખ્યું.  
 લોહી નીતરતું માથું લઈને  
 સિદ્ધરાજ રાણકદેવી પાસે આવીને કહે છે.  
 જો આને,  
 હજુ કહું છું માની જ.  
 નહીં તો તારા બંને દીકરાઓના ય માથા કાપી નાંખીશ...”  
 આટલું કહેતાની સાથે  
 સિદ્ધરાજે એની સામે જ  
 એના બંને દીકરાઓના માથા કાપી નાંખ્યા.  
 રાણકદેવીએ આ જોતાની સાથે

સિંહાણની જેમ સિદ્ધરાજ પર તરાપ મારી  
 એની પાસેની કટાર છિનવી લીધી.  
 સિદ્ધરાજનું મોત એના માથે આવી ગયું.  
 રાણકદેવીએ કહ્યું, “હત્યારા !  
 તે મને વિધવા બનાવી દીધી  
 પણ હું તારી આ ગુજરાતની ધરતીને વિધવા બનાવીને  
 તારી મા ને રડાવવા નથી માંગતી.  
 છતાં મારું અંતર કહે છે કે  
 જેવી તે મારી ને મારા રાજ્યની ફુર્દ્શા કરી છે,  
 એવી મ્લેચ્છો દ્વારા તારા રાજ્યની પણ ફુર્દ્શા થશે.  
 હજુ પણ છોપી હે આ લંપટતાને.”  
 સિદ્ધરાજ સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો છે  
 ને રાણકદેવી પોતાના શીલની રક્ષા માટે  
 એ કટારને પોતાની છાતીમાં ભોકીને ઢળી પડે છે.  
 આ દશ્ય જોઈને સિદ્ધરાજ બેમાન થઈ જાય છે.  
 ભાનમાં આવીને ધ્રુસકે ધ્રુસકે રડે છે.  
 ઘોર પશ્ચાત્તાપ સાથે પતિ-પુત્રો સાથે એનો અશ્રિસંસ્કાર કરે છે.  
 અને એ જ જગ્યાએ એક ભવ્ય મંદિર બનાવીને  
 એની મૂર્તિ બેસાડે છે.  
 આજે પણ એ રાણકદેવીનું મંદિર ને એ મૂર્તિ હૃયાત છે.  
 જે દુનિયા આખીને પ્રેરણા આપે છે.  
 કે શીલ વેંચીને મહદાની જેમ જીવવા કરતા  
 શીલની રક્ષા કરીને અમર થઈ જવું લાખગણું બહેતર છે.



## \* Plz. Ask Once \*

બાલંભાના રાજા રાજસિંહ.

એમની રાજકુમારી સોહનદેવી,

પરાકાણનું રૂપ ને પરાકાણની વિદ્વતા.

ઓણે પ્રતિજ્ઞા કરી કે

“જે મારી કાવ્ય સમસ્યાની પૂર્તિ કરશો,

અની જ સાથે હું લગ્ન કરીશ.”

કાઠિયાવાડમાં ઘૂમલીના રાજ શિયાળના દરખારમાં,

એ સમસ્યા લઈને દૂત પહોંચ્યો.

રાજકુમાર સાલામને એ સમસ્યાની પૂર્તિ કરી દીધી.

સગપણ થયું. વિવાહની તિથિ નક્કી થઈ

પણ રાજાનું મન બગડ્યું.

એને પોતાને સોહનદેવીને પરાણવાની ઈચ્છા થઈ.

એ માટે ઓણે કાવતરું કર્યું.

પ્રજાને ખબર પડી ગઈ.

એ રાજાને ધિક્કારવા લાગી.

રાજકુમાર એક આધાત સાથે એ રાજ્ય છોડી નીકળી ગયો.

રાજાને આનંદ થયો.

એ સીધો સોહનદેવી પાસે પહોંચ્યો ગયો.

પોતાની સાથે વિવાહ કરવાનો આગ્રહ કરવા લાગ્યો.

જેની સાથે સગપણ થયું એનો પત્તો નથી.

એક રાજ પોતાની રાણી બનાવવા કરગારી રહ્યો છે.

સત્તા અને સંપત્તિ બંને એક સાથે મળી રહ્યા છે.

એમાં બિલકુલ લોભાયા વિના

સોહનદેવી સિંહણની જેમ ગર્જ ઉઠે છે.

“દુષ્ટ, બેશરમ, તમારું કાળું મોં લઈને નીકળી જાઓ અહીંથી.  
તમારી પુત્રવધૂ પાસે આવી ગંદી માંગણી કરતા  
તમને થોડી પાણ શરમ નથી આવતી ?”

પણ રાજા શિયાજી પર આ વાતની કોઈ અસર ન થઈ.

એ જબરદસ્તી કરવા સુધી નીચે ઉત્તરી આવ્યો.

સોહુનદેવીએ પોતાના શીલની રક્ષા માટે

એની પાસેની કટાર છિનવી લીધી

ને એની છાતીમાં ભોંકી દીધી.

રાજાનું પ્રાણપંખેરું ઉડી ગયું.

રાજકુમારની શોધ કરાવી સોહુનદેવી એને પરાડી.

ધૂમલીના રાજ્યમાં એ રાજકુમારનો રાજ્યાભિષેક થયો.

દૂધનું દૂધ ને પાણીનું પાણી તઈ ગયું.

વહેલું કે મોકું તો થવાનું જ છે.

શીલભ્રષ્ટ બધી જ રીતે દુઃખી થશે.

શીલસંપત્ત બધી જ રીતે સુખી થશે.

ઉજુ આ સ્થૂલ વાત છે.

એક નારી માટે.... એક નર માટે... એક મનુષ્ય માટે તો

શીલ એ જ સુખ હોય છે.

શીલભ્રષ્ટતા એ જ દુઃખ હોય છે.

હું મનુષ્ય છું એટલું જ પૂરતું છે

કે હું શીલભ્રષ્ટ ન જ હોઈ શકું.

જો આપણને આટલી સિંગલ ફીલિંગ્સ ન થતી હોય

તો આપણો આપણને પૂછવું જોઈએ.

શું હું માણસ નથી ? શું હું પશુ છું ?

Plz Ask once.

Who are we ?



## \* Eyes or Movie ? \*

કલકતાની પાસેનું ગામડું.

સતત દુકાળોથી ભરડામાં આવેલો એક પરિવાર.

એ પરિવારના પ્રેમાનંદ નામના સભ્યને

નિર્દ્ય અમલદારે બંધી બનાવ્યો.

એના જીવનની આશા છોડીને

પરિવારના બીજા સદસ્યો તો રંગપુર જતા રહ્યા.

પણ પ્રેમાનંદની પત્ની સત્યવતીએ વિચાર કર્યો.

‘નવા નગરમાં પતિ વિના મારી શીલરક્ષાનું શું ?

જંગલમાં મને તકલીફો પડશે.

ખાવા-પીવાના ટેકપણા નહીં હોય.

સુખોનો દુકાળ હુશે ને દુઃખોનો સુકાળ હુશે.

પણ મારી શીલરક્ષા ત્યાં થઈ શકશે...’

સત્યવતીએ વર્ષો સુધી જંગલમાં રહેવું પસંદ કર્યુ.

દરમિયાન એના સસરાને બંધી બનાવી લેવાયા.

તો એમને છોડાવ્યા.

બાર વર્ધની મહેનત બાંદ

એને જાણ થઈ કે એના પતિ કલકતાની જેલમાં છે.

બહાવરી બનીને એ કલકતા પહોંચ્યી છે.

જેલની ભાળ મેળવીને એ ત્યાં ય પહોંચ્યી છે.

પણ

નથી પૈસા, નથી લાગવગ, એ શું કરી શકે ?

છતાં જેલની બહાર એ બેઠી છે.

પ્રભુને ગ્રાર્થના કરી રહી છે.

એ સમયે ત્યાંથી કોઈ ઉતાવળે પસાર થયું.

એની પાસે એક બેગ હતી તે પડી ગઈ.

અને ખબર ન હતી.

સત્યવતીએ તે માણસને તેની બેગ આપી.

એ માણસ ગળગળો થઈ ગયો.

‘જો તમે મને આ બેગ ન આપી હોત

તો હું ખરેખર લૂંટાઈ ગયો હોત.

બોલો, હું તમારી માટે શું કરી શકું...?’

સત્યવતીએ પોતાની વાત કરી.

એ માણસે બધી કાર્યવાહી કરી.

પ્રેમાનંદને મુક્ત કરવાનો આદેશપત્ર મેળવ્યો.

સત્યવતી પુરુષવેષમાં સજ્જ થઈ જેલમાં આવી.

પ્રેમાનંદને બહાર લાવવામાં આવ્યા.

સત્યવતીની આંખોમાંથી દડડ આંસું પડવા લાગ્યા.

બાર વર્ષ પછી.. કેટકેટલા કષો વેઠ્યા પછી

અને એના પતિ મળ્યા...

એની સતીત્વની સાધના ફળી...

સત્યવતી ધારત

તો મારા સુખનું શું ?

મારા સપનાનું શું ?

મારી આશાઓનું શું ?

આવા પ્રશ્નોના ઓડા હેઠળ

હુલકા રસ્તે પોતાનું સુખ શોધી શકત.

પણ એવું એણે ન કર્યું.

કારણ કે એ એવું ધારી જ ન શકી.

કારણ કે એ કોઈ કૂતરી ન હતી.

કોઈ ભૂંડણા કે ગઢેડી પણ ન હતી.

એ હતી નારી.

શુદ્ધ નારી.

નારીતવના ભોગે મળતું સુખ હકીકતમાં ભ્રમણ હોય છે.

જ્યારે તમારી આંખો જ ફેરી દેવાતી હોય

ત્યારે તમને અપાઈ રહેલ સિનેમા ટિકિટોનો

કોઈ જ અર્થ રહેતો નથી.



### \* Never Third \*

સિંહલ દ્વીપના રાજા હતા ગંધર્વસેન.

એમની પુત્રી હતી પદ્માવતી.

એના વિવાહ ચિત્તોડના રાજા રતનસિંહજી સાથે થયા હતા.

દિલ્હીના બાદશાહ અલ્લાઉદીન ખીલજી

એના પર આસકત થઈને ચિત્તોડ પર આક્રમણ કરવા સેના લઈને આવ્યા.

પણ એમાં ફાવ્યો નહીં.

તો કપટથી રતનસિંહજીને બંદી બનાવી દીધા.

અને જ્યાં સુધી પદ્માવતી પોતાને ન સોંપાય

ત્યાં સુધી તેમને નહીં છોડું એવી ધમકી આપી.

પદ્માવતી ઈચ્છત તો એ દિલ્હીની રાણી બની શકત.

પદ્માવતી ઈચ્છત તો દુનિયાભરના સુખસાધનો પામી શકત.

પણ પદ્માવતી બરાબર સમજતી હતી.

કે શીલ વેંચવાનો સૌધો અર્થ છે જાત વેંચવી.

આ સોઢો મૂર્ખાઓ જ કરે,

કારણ કે જ્યારે તમે જ વેંચાઈ ગયા હો,

ત્યારે તમને શું મળ્યું -

એ વાતનો કોઈ અર્થ જ રહેતો નથી.

પદ્માવતીએ પરિવારના સભ્યો સાથે ગંભીર વિચારણા કરી.

બાદશાહને કહેવડાયું કે “મને તમારી શરત મંજૂર છે.

હું ૭૦૦ સખીઓ સાથે તમારી પાસે આવીશા,

ત્યારે તમારી સેના કોઈ અશાંતિ ન કરે.”

બાદશાહ ખુશ થઈ ગયો.

રતનસિંહજીને છોડી દીધા.

૭૦૧ પાલખીઓ સામેથી આવી રહી છે.

દરેક પાલખી ૮-૮ સ્વીઓએ ઉપાડી હોય એવું દશ્ય છે.

બાદશાહના મનમાં ગલગલિયા થઈ રહ્યા છે.

આખી સેના અનેરી આશાઓમાં રાચી રહી છે.

બધી જ પાલખીઓ લગોલગ આવી ચૂકી છે...

ને આ શું ?

દરેક પાલખીમાંથી સશાખ સૈનિકો છલાંગ લગાવે છે.

પાલખી ઉપાડનારી બધી જ સ્વીઓ સ્વીઓ મટીને

સશાખ સૈનિકરૂપે પ્રગટ થાય છે.

બાદશાહ ને એની આખી સેના પર એ બધાં તૂટી પડે છે.

અણધાર્યા હુમલાથી એ બધાનો કચ્ચયરઘાણ વળી જાય છે.

બાદશાહ માંડ માંડ જીવ બચાવીને દિલહી પદ્ધોંચે છે.

આનો બદલો લેવા માટે ફરી અત્યંત વિશાળ સેના સાથે આવીને  
ચિતોડને ઘેરી લે છે.

પદ્માવતી હુવેની પરિસ્થિતિ સમજી જાય છે.

મહેલની નીચે એક અગ્રિકુંડ તૈયાર કરે છે.

રાજા સેના સાથે રણભૂમિમાં ઝડૂમી રહ્યા છે.

આટલી બધી વિશાળ સેના સામે લડતા લડતા

રાજા અને બીજા પણ રજપૂતો મૃત્યુ પામે છે.

એ સમાચાર મળતાની સાથે

પદ્માવતી હજરો રજપૂતાણીઓની સાથે  
 એ સળગતા અશ્રિકુંડમાં ઝંપલાવી હે છે.  
 વિજયના નશા સાથે અદ્વાઉદીન જ્યારે ત્યાં આવી પહોંચે છે.  
 ત્યારે એના હાથમાં  
 રાખથી વધુ કશું જ આવતું નથી.  
 એ હાય હાય કરતો દિલહી ભેગો થઈ જાય છે.  
 આજે પણ એ જગ્યાએ  
 રાણી પદ્માવતીનું મંદિર છે.  
 જેમાં પદ્માવતી રાણીની પ્રતિમા સંદેશ આપી રહી છે.  
 કે એક સ્વીને  
 યા એનો પતિ અડી શકે  
 યા અશ્રિ અડી શકે.  
 ત્રીજા કોઈની મજાલ નથી કે એને અડી શકે  
 પછી ભલેને એ દિલહીનો બાદશાહ પણ કેમ ન હોય ?



\* યા શીલ... યા કશું નહીં... \*

વીરમતી.  
 ધારાનગરીના રાજા ઉદ્યાદિત્યની દીકરી.  
 ટેઠાના યુવરાજ જગદેવ સાથે એના વિવાહ થયા.  
 જગદેવની સાવકી મા ઈર્ઘાથી પડ્યંત્ર રચવા લાગી  
 જેથી એનો દીકરો રાજા બને.  
 જગદેવ બધું છોડીને રાતે પત્ની સાથે નીકળી પડે છે.  
 ને ગુજરાતની રાજધાની પાટણમાં આવે છે.  
 વીરમતીને એક ઉપવનમાં બેસાડીને  
 રહેવાની જગ્યા જોવા માટે એ પાટણ શહેરમાં અંદર જાય છે.

પાટણની એક વેશ્યા હતી - જામોતી.  
 અની દાસીની નજર વીરમતી પર પડી.  
 ઓણે વેશ્યાને વાત કરી.  
 એ વીરમતીના ફેબા હોવાનું નાટક કરીને  
 અને પોતાને ત્યાં લઈ આવી.  
 વીરમતીને ખ્યાલ આવ્યો કે  
 અને ફસાવવામાં આવી છે.  
 ત્યાં તો ત્યાંના કોટવાલના દીકરા-લાલિયાને  
 એના રૂમમાં મોકલવામાં આવ્યો.  
 અને કાઢી મુકવા માટે વીરમતીએ ખૂબ પ્રયાસ કર્યો.  
 પણ એમાં નિષ્ફળ જતા એણે બીજો ઉપાય અજમાવ્યો.  
 ઉપર ઉપરથી પ્રેમ બતાવીને  
 અને એવો સ્ટ્રોંગ દારુ પીવડાવી દીધો  
 કે એ ત્યારે જ બેભાન થઈ ગયો.  
 વીરમતીએ પોતાના શીલની રક્ષા કરવા માટે  
 અની કટાર કાઢીને અની જ છાતીમાં હુલાવી દીધી.  
 ને એના મડદાના પાંચ-છ ટુકડા કરી કોથળામાં નાંખી  
 બારીમાંથી રાજમાર્ગ પર ફેંકી દીધા.  
 થોડીવારમાં ત્યાંથી ચોકીદાર પસાર થયો.  
 કોથળો જોઈને ચમક્યો.  
 એ કોથળો કોટવાલને આવ્યો  
 કોટવાલ ત્યાં સિપાઈઓને લઈને આવ્યો.  
 પણ રૂમ તો અંદરથી બંધ હતો.  
 ફક્ત એક બારી એવી હતી  
 જેમાં કપાટ ન હોવાથી ખુલ્લી જ હતી.  
 એક સિપાઈ ત્યાં સીરી મુકીને ચડ્યો.

જેવું એણે અંદર તોકિયું કર્યું  
 તેવું વીરમતીએ એનું માથું કાપી નાખ્યું.  
 માથું રૂમમાં પડ્યું અને ધડ બહાર.  
 બીજો સિપાઈ ચડ્યો... એની ય એ જ દશા...  
 ત્રીજો... ચોથો... પાંચમો.. છટઠો... સાતમો  
 બધાની એ જ દશા... બધા ગભરાયા...  
 સિદ્ધરાજને બધી વાત કરી.  
 રાજ પોતે આવ્યો.  
 સાથે જગદેવ પણ આવ્યો.  
 રાજાએ એ રૂમ પાસે જઈને કહ્યું.  
 “હું અહીંનો રાજ સિદ્ધરાજ છું. રૂમમાં પુરુષ કે સ્ત્રી જે પણ હોય,  
 એ મને આ ઉત્પાતનું કારણ કહે.”  
 વીરમતીએ બધી વાત કહી  
 એટલે જગદેવે કહ્યું,  
 “તું એકદમ નિર્ભય થઈને દરવાજો ખોલી દે.”  
 વીરમતીએ દરવાજો ખોલ્યો,  
 પતિના ચરણોમાં પડીને ધૂસકે ધૂસકે રડી પડી.  
 રાજાએ એને આશાસન આપ્યું. બંનેને પોતાના મહેલમાં લઈ જઈ વીરમતીને  
 દીકરી જેવું સ્થાન આપ્યું.  
 કોટવાળ અને વેશ્યાનો દેશનિકાલ કર્યો.  
 અને જગદેવનું રાજ્ય એને આપાવી એનું સમ્માન વધાર્યું.  
 વીરમતી આજે ય આપણાને કહી રહી છે -  
 તમે ફક્ત શીલ બચાવી લો,  
 તમારું બધું જ બચી જશો.



## \* Decoration of a Dead-Body \*

બુંદેલ ખંડના રાજા ચંદેલની પુત્રી દુર્ગાવતી.  
 ગોંડ રાજા સાથે એના વિવાહ થયા.  
 એક દીકરાનો જન્મ થયો.  
 ને એ વિધવા થઈ.  
 વૈધવ્યના દુઃખને જરવી લઈ  
 દુર્ગાવતીએ બે જવાબદારી ઉપાડી લીધી.  
 એક-રાજકુમારના ઉછેરની  
 બીજી-રાજ્યના સંચાલનની.  
 આ પરિસ્થિતિ જાણીને  
 અકબરના એક સરદારને તેનો ગેરલાભ લેવાનું મન થયું.  
 એનું નામ હતું આસિફ ખાં.  
 એ વિશાળ સેના સાથે ચડી આવ્યો.  
 દુર્ગાવતીએ પોતાની સેનાને સજજ કરી  
 અને પોતે ય શાસ્ત્રોથી સજજ થઈને  
 બાળ રાજકુમારને પીઠ પર બાંધીને  
 રણમેદાનમાં ઉત્તરી આવી.  
 તેને જોઈને એક એક સિપાઈના જોશના  
 ગુણપાકાર થઈ ગયા.  
 બધા દુશ્મનો પર એવા તૂટી પડ્યા  
 કે એ બધાએ ઉભી પુંછડીએ ભાગલું પડ્યું.  
 આસિફ ખાં ખરાબ રીતે અપમાનિત થયો,  
 એ બીજી વાર વિશાળ સેના લઈને ચડી આવ્યો.  
 દુર્ગાવતીએ બીજી વાર પણ એની એ જ દશા કરી.  
 એ ત્રીજી વાર આવ્યો.

દુર્ગાવતી પૂરા પરાક્રમ સાથે લડી રહી હતી.

પણ એને અચાનક ઘ્યાલ આવ્યો.

કે બાળ-રાજકુમાર ઘાયલ થઈ રહ્યો છે.

એણે તરત એને તંબુમાં લઈ જવાનો આદેશ આવ્યો.

ને પોતે ફરી પુષ્ટ કરવા લાગ્યો.

પણ અચાનક એક તીર આવ્યું.

ને એની આંખમાં વાયું.

દુર્ગાવતીએ પોતાના હૃથથી એને ખેંચી કાઢ્યું.

ત્યાં એક તીર સીધું ગળા પર લાગ્યું.

ઘણું બધું લોહી વહી ગયું.

દુર્ગાવતીને ચક્કર આવી ગયા.

શત્રુસેનાએ એને ચારે બાજુથી ઘેરી લીધી.

દુર્ગાવતી સમજી ગઈ

કે હવે એનું શીલ જોખમમાં છે.

શત્રુઓ એને જો જીવતી પકડી લેશે

તો સારવાર કરીને એનું જીવન તો લંબાવી દેશે

પણ

એનું શીલનું જીવન પૂરું થઈ જશે.

દુર્ગાવતીને એ હુરળીઝ મંજૂર ન હતું.

કારણ કે તે એક નારી હતી.

શુદ્ધ નારી.

ક્ષણના સોમાં ભાગમાં એ નિર્ણય લઈ લે છે.

પોતાની છાતીમાં પોતાના હૃથે જ

બછી ખોસી દે છે.

એક ભારતીય નારીની ખુમારી, ખમીરી

અને શીલરક્ષાને સલામ કરવા સિવાય

દુશ્મનો પાસે બીજો કોઈ વિકલ્પ જ બયથો નથી.

શીલ એ જ સર્વસ્વ છે.  
 શીલ વિના બીજું બધું જ ખોખલું છે.  
 શીલ વિનાનો પૈસો, સુખ, નામના  
 આ બધું જ મડદાંનો શાણગાર છે.  
 જે મળી પણ જાય.  
 તો ય એનો કોઈ જ અર્થ નથી.



### \* સ્વર \* \*

રૂપ દેખીતી રીતે તો સારું લાગે છે  
 પણ રૂપના કારણે જ આજ સુધીમાં  
 કરોડો માથા કપાઈ ચૂક્યા છે.  
 લોહીની નદીઓ વહી ચૂકી છે  
 કરોડો નારીઓ વિધવા થઈ ચૂકી છે.  
 કરોડો સંતાનો અનાથ થઈ ચૂક્યા છે.  
 આખી આખી નગરીઓ બધી જ રીતે લૂંટાઈ છે.  
 રૂપ ફક્ત પતિ માટે હોય તો ઠીક છે.  
 રૂપ જ્યારે પતિ સિવાયની વ્યક્તિને દેખાડવામાં આવે,  
 ત્યારે હોનારતોની વણજ્ઞારોને આમંત્રણ આપવામાં આવે છે.  
 આજે ય દેખીતા યુદ્ધો ભલે ન હોય  
 પણ રોજ રોજ  
 કરોડો સ્ત્રીત્વના માથા કપાઈ રહ્યા છે.  
 શીલના લોહીની નદીઓ વહી રહી છે.  
 ચારિત્રની હત્યા કરોડોને વિધવા બનાવી રહી છે.

સેકડો સદ્ગુણો સાવ જ અનાથ થઈ રહ્યા છે.

ને દુનિયા આખી બધી જ રીતે લૂંટાઈ રહી છે.

બહેન !

આ જ રૂપ.. રૂપનું પ્રદર્શન.. સહચાર.. કહેવાતી ફેન્દ્શીપ..

કહેવાતું Just Fun... આએ જ આખી ય સ્વીજાતિની

ઘોર ખોટી નાંખી છે.

એક સ્વી આ બધાની પાછળ દોડે છે.

ત્યારે સો સ્વીઓ સીધી કે આડકતરી રીતે

ખલાસ થઈ જાય છે.

આ બધાનો વિચાર કરશો તો

રૂપ, સ્પર્શ, વિષયતૃભુગ્ય - આ બધા માટે નફરત છૂટી જશે.

બહેન !

આ અવતાર શીલસંપત્ત થઈને

'દેવી' થવા માટે છે, પશુ થવા માટે નહીં.

સ્વી જો Original છે

તો એના જેવું Status બીજું કોઈ જ નથી.

ને જો એ ભણ થઈ ચૂકી

તો એનાથી વધુ

નામોશી અને બરબાદી બીજુ કોઈ જ નથી.

આટઆટલી રાણીઓ ને રાજકુમારીઓ

કંઈ મૂરખી ન હતી,

કે શીલ માટે પોતાના પ્રાણોની ય આહૂતિ આપી દે,

અહીં જે ઘટનાઓ કહી છે,

તે તો ફક્ત એક જલક છે.

ઈતિહાસના લાખો પાનાઓ પર

આવી Originals ની સ્વર્ણિમ છબીઓ લાગેલી છે.

જે તમને એ જ સંદેશ આપે છે  
 કે તમે સ્વી થઈને  
 સ્વીત્વને લાક્ષ્ણિત ન કરતા.  
 વિશુદ્ધ શીલ પાળીને  
 સ્વીત્વની આબરૂ વધારજો,  
 અના ખાતર બીજું બધું જ જતું કરજો.  
 પણ એને સાચવી લેજો.  
 જે છુપાવવું પડે, જે આજીવન ઉંખતું રહે,  
 જેનાથી કુણને કલંક લાગે  
 જેનાથી મા-બાપને આઘાત લાગે  
 જેની બધા જ ધર્મોએ-બધા જ ભગવાનોએ  
 સાફ સાફ ના પાડી છે.  
 તમારો અંતરાત્મા પણ જે કરવાની ના પાડે છે  
 જેના પરિણામો દુઃખ અને ભયાનક છે.  
 તેને દૂરથી છોડીને  
 Original બની રહેવામાં જ Benefit છે.  
 Wish you all the best.



### BOOKS FOR THE GENERAL PUBLIC

- |                                 |                                    |
|---------------------------------|------------------------------------|
| ૧. જૈન સાધુ અને પર્યવરણ         | - રસમદ માહિતી                      |
| ૨. જગતહિતકરની (?) (દિન)         | - એક વિરોધ અધ્યયન                  |
| ૩. ગિરિરાજ ગુંજન (ગુ. દિન. અં.) | - સચિત્ર બાળસામાહિક - અંક ૧ થી ૪   |
| ૪. ગિરિરાજ ગુંજન (ગુ. દિન. અં.) | - સચિત્ર બાળસામાહિક - અંક ૫ થી ૮   |
| ૫. ગિરિરાજ ગુંજન (ગુ. દિન. અં.) | - સચિત્ર બાળસામાહિક - અંક ૬ થી ૧૨  |
| ૬. ગિરિરાજ ગુંજન (ગુ. દિન. અં.) | - સચિત્ર બાળસામાહિક - અંક ૧૩ થી ૧૬ |

### BOOKS FOR THE JAINS

- |                     |                                     |
|---------------------|-------------------------------------|
| ૧. સંધ્યાત્રા       | - આમંત્રણ ગાઈડ                      |
| ૨. વલોષું           | - વિવિધ લેખો                        |
| ૩. Defence જિનશાસન  | - ગિરિરાજ સુરક્ષા - પ્રેરણા + પ્લાન |
| ૪. પ્રશામરતિ અમૃતમૃ | - આંશિક રસાસ્વાદ                    |
| ૫. Secure જિનશાસન   | - કન્યા ૩ - તપોવન - પ્રેરણા + પ્લાન |
| ૬. My સંસ્કાર Card  | - બાળસંસ્કરણ નોંધપોથી               |
| ૭. ચૈત્ર સુદ તેરસ   | - જન્મ કલ્યાણકની ભીતરથાં            |
| ૮. Plan જિનશાસન     | - એવું સુંદર સપનું મારું સાકાર હોયો |

### BOOKS FOR GURU BHAGWANTS

- |                  |               |
|------------------|---------------|
| ૧. સમ્મતિ સંવાદ  | - શ્રમણ વાચના |
| ૨. સૌભાગ્ય સંવાદ | - શ્રમણ વાચના |

### PEMPFLATE FOR JAINS

- |                               |  |
|-------------------------------|--|
| a. શાસનસેવા                   | - આજીવન ચાર્જિંગ                             |
| b. સોળ વર્ઝનો સરવાળો          | - શાંબ-પ્રદુમન સાધના (ફાગણ સુદ ૧૩ શ્રેણિમાં) |
| c. સગાઈ                       | - દીક્ષા-પત્રિકા કોન્સેપ્ટ                   |
| d. મુમુક્ષુના પરિવારને        | - ટિપ્સ                                      |
| e. મુમુક્ષુના યજમાનને         | - ટિપ્સ                                      |
| f. 13 Q. on કોરોના & દેરાસર - | ગાઈડલાઈન ટિપ્સ                               |
| g. પ્રગતિની પગાંડી            | - સાધર્મિકને પ્રેરણાપત્ર                     |

Book link - [bit.ly/priyambooks](http://bit.ly/priyambooks)

આના દ્વારા પુસ્તકોની Soft Copy Free મળશે.

આપ જરૂર મુજબ પ્રિન્ટ કાઢી શકશો.

**With Best Compliments  
From**



Priyam's All Books



ASHAP0026